

## પ્રોએક્ટીવ ડીસ્કલોગ્ર

**કચેરીનું નામ:- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત  
મુદ્દા નંબર :- ૧ પોતાના વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજોની વિગત**

### પરિચય

કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી તરફથી પ્રાપ્ય ૧૦૦ % ગ્રાન્ટથી ચાલતી "દ્રાન્સફર ઓફ ટેકનોલોજી" માટેની વિસ્તરણ શિક્ષણ યોજના છે. ભારત સરકારે દેશના તમામ રાજ્યોના પ્રત્યેક જિલ્લામાં એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવાનું નક્કી કરેલ છે. તે મુજબ હાલ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક-એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંજૂર કરવામાં આવેલ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કાર્યક્ષેત્ર જે તે જિલ્લો હોય છે. કેન્દ્ર હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હાથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગામોના જૂથ નક્કી કરીને ખેડૂતોને કૃષિ, બાગાયત, પાક સંરક્ષણ, પશુપાલન, મરધાંઉછેર, મત્સ્યપાલન, ગૃહવિજ્ઞાન વિ.ની નવીન ટેકનોલોજીથી વાકેફ કરવા માટે કેન્દ્ર બહાર તથા કેન્દ્ર પર એક/ચાર દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે.

૧. સ્થાપનાનું વર્ષ	:	૧. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.પુ., સુરત	૨૦૧૨
૨. યોજનાનો પ્રકાર	:	ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી (ભારત સરકાર)ની ૧૦૦ % ગ્રાન્ટથી ચાલતી "દ્રાન્સફર ઓફ ટેકનોલોજી" માટેની વિસ્તરણ શિક્ષણ યોજના છે.	
૩. હેતુઓ/ઉદ્દેશો (Mandates)	:	<p>૧. ખેડૂતો અને ગ્રામીણ યુવાનો માટે "કાર્ય દ્વારા શિક્ષણ" પર ભાર મુકીને કૃષિ અને સંલગ્નવિષયો અંગે ટૂકાં તેમજ લાંબાગાળાના વ્યાવસાયિક તાલીમવર્ગો યોજીને સ્વરોજગારી વધારવાનો પ્રયત્ન કરવો.</p> <p>૨. નવીન કૃષિ તજશતાઓ અંગે ખેડૂતોના પ્રતિભાવો જાણવા માટે ખેડૂતોના ખેતરો ઉપર વિવિધ પાકોના પ્રથમ હરોળના નિર્દર્શનો (Front line demonstrations) યોજવા.</p> <p>૩. સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવવા સારુ નવી બહાર પાડવામાં આવતી કૃષિ તજશતાઓની જુદી જુદી કૃષિ-આબોહવાકીય પરિસ્થિતિમાં યોગ્યતા અને અનુકૂળતા ચકાસવા માટે તથા ખેડૂતોને તે પ્રત્યક્ષ બતાવવા માટે ખેડૂતોના ખેતરો પર ક્ષેત્રિય-અભતરા (On-farm trials)નું આયોજન કરવું.</p> <p>૪. કૃષિ અને સંલગ્ન વિષયોના સંશોધનો સંબંધી અધ્યતનમાહિતી અંગે જે તે કાર્યક્ષેત્ર વિસ્તારના વિસ્તરણ કાર્યકરો/અધિકારીઓને જાણકારી આપીને નવીન તજશતા અંગેના જ્ઞાનમાં વધારો કરવા માટે નિયમિત રીતે તાલીમ કાર્યક્રમો યોજવા.</p> <p>૫. જીલ્લાનું કૃષિ સંલગ્ન જ્ઞાન કેન્દ્ર (Knowledge Centre) તરીકે વિકસાવવું.</p>	
૪. કામગીરી	:	કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કાર્યક્ષેત્ર જે તે જિલ્લો હોય છે. કેન્દ્ર હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હાથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગામોના જૂથ નક્કી કરીને ખેડૂતોને કૃષિ, પશુપાલન, મરધાંઉછેર, મત્સ્યપાલન, ગૃહવિજ્ઞાન વિગેરેની નવીન ટેકનોલોજીથી વાકેફ કરવા માટે કેન્દ્ર બહાર તથા કેન્દ્ર પર એક દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. કૃષિ તાંત્રિકીનો અસરકારક પ્રચાર અને પ્રસાર કરવા તથા કાર્યક્ષેત્ર હેઠળના ખેડૂતો સાથે સતત સંપર્ક જાળવી રાખવા માટે કેન્દ્ર દ્વારા ખેડૂતદિન, ખેડૂત શિબિર, ફીલ્ડ ટ્રીપ, પદ્ધતિ નિર્દર્શનો, કૃષિપ્રદર્શન, કૃષિમેળો, ફિલ્મ શો જેવી વિસ્તરણ પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે	

		છે. ખેડૂતોના ખેતરે અગ્રીમ હરોળ નિર્દર્શનો ગોઠવી નવી તાંત્રીકતાઓ ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે. સંલગ્ન વિભાગોનાં તાંત્રીક મહેકમને આધુનીક સંશોધનથી માહિતગાર કરવા તેઓને માટે ખાસ રીફરેશર તાલીમો આપવામાં આવે છે. કૃષિ સંલગ્ન વ્યવસાયને લગતી વ્યવસાયિક તાલીમો આપવામાં આવે છે.
--	--	--

## મુદ્દા નંબર :— ૨ પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત હેઠળ ફરજ બજાવતાં તાંત્રીક અધિકારીશ્રી/કર્મચારીઓ માટે કામગીરીની વહેચણી.

### (૧) ડૉ. જે. એચ. રાઠોડ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા

૧	કેન્દ્ર ખાતે ચાલતી તમામ પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને વહીવટી સંચાલન
૨	કેન્દ્રની વડી કચેરી દ્વારા સૌંપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી
૩	કચેરીના ખાનગી પત્રવ્યવહાર
૪	હેડ ઓફ યુનિટ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા હિસાબી વહીવટી કામગીરીની તમામ ટેખરેખ તથા તાંત્રીક માર્ગદર્શન અને નિયંત્રણ
૫	વિસ્તરણની કેન્દ્ર ખાતેની યોજનાઓનું આયોજન અને અમલની કામગીરી.
૬	યુનિવર્સિટી કક્ષાની તથા મા. સરકારશ્રીની વખતો વખતની બેઠકોમાં હાજરી આપવી.
૭	યુનિ.અધિકારી તરીકે બધી યોજના(આયોજીત, બીનઆયોજીત, અન્ય)ની જવાબદારી નિભાવણી.
૮	મા.કુલપતિશ્રી, ડાયરેક્ટર-અટારી તથા મા.વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી સાથે પત્ર વ્યવહાર તથા રીપોર્ટિંગની કામગીરી
૯	વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકની કામગીરીનું આયોજન અને અમલ

### (૨) ખાલી જગ્યા, વૈજ્ઞાનિક (વિસ્તરણ)(ટી-૧)

૧	પસંદ કરેલ ગામોમાં PRA/ Benchmark Survey/Need Assessment/ Identification of Thrust area સંબંધી કામગીરી.
૨	વિસ્તરણ શિક્ષણ વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલ/ રેકૉર્ડની જાળવણી.
૩	કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સમગ્ર પ્રવૃત્તિઓ / કાર્યક્રમોનું મધ્યસ્થ નોંધણી રજીસ્ટર નિભાવવું, ડોક્યુમેન્ટેશન કરવું તથા સિદ્ધિઓના રેકૉર્ડની જાળવણી.
૪	વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ(SAC) ની બેઠકનું આયોજન, મુદ્દાનોંધ, કાર્યનોંધ વિ. તમામ કામગીરી.
૫	કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માસિક/ત્રિમાસિક/વાર્ષિક અહેવાલ તૈયાર કરવા, કેવિકે પોર્ટલ તથા અન્ય વેબસાઈટ પર અપલોડ કરવા તથા સમયાંતરે સંબંધિતને મોકલવાની કામગીરી.
૬	કૃષિ સાહિત્ય પ્રકાશનને લગતી કામગીરી.
૭	આકાશવાણી, દૂરદર્શન, પ્રાઇવેટ ચેનલો કૃષિ વિષયક લેખો વિ. સંબંધી પત્રવ્યવહાર અને ફાઈલો નિભાવવાની કામગીરી.
૮	સેમિનાર/વર્કશોપ/પરિસંવાદ/કોન્ફરન્સ/વ્યાખ્યાન/તાંત્રીક ચુપ મિટિંગ વિ. નું આયોજન, સંકલન, અમલ અને પત્રવ્યવહાર.
૯	વિસ્તરણ શિક્ષણ પરિષદ તથા નિયામક મંડળની બેઠક માટે જરૂરી તાંત્રીક માહિતી અને મુદ્દાનોંધ તૈયાર કરવી.
૧૦	કચેરીમાં તાંત્રીક માહિતી અને ખેડૂતોપયોગી સાહિત્યની ડિસ્પ્લે સિસ્ટમ ગોઠવવી. નેઈમ પ્લેટ, સાઈનબોર્ડ, વિ. તૈયાર કરવાની કામગીરી.
૧૧	વિષયને લગતી સફળ વાર્તા/ કેસ સ્ટડી/ઈમ્પેક્ટ સ્ટડી તૈયાર કરીને યોગ્યજગ્યા અને સમયે તેની લેખિત તથા મૌખિક રજૂઆત કરવી.
૧૨	વિસ્તરણ શિક્ષણ સંબંધી નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૧૩	કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓનું સમયાંતરે Impact Assessment કરવું
૧૪	યુનિવર્સિટી, જિલ્લા / દ્રાયબલ સભાપાલાન, સંકલન સરકારી / સહકારી / સ્વૈચ્છિક સંસ્થાઓ અને ડાયરેક્ટર ATARI સાથે પત્રવ્યવહાર અને ICAR ફાઈલોની જાળવણી.

૧૫	પ્રેસનોટ, પત્રકાર પરિષદ, પ્રેસનોટ પ્રસિદ્ધિ તથા ડેનિકપત્રમાં પ્રસિદ્ધિ, થયેલ પ્રેસનોટનું નિયમિત કટિંગ કરીને ફાઈલો નિભાવવાની કામગીરી કરવી.
૧૬	શ્રેષ્ઠ કેવિકે એવોડ, સરદાર પટેલ એવોડ, અસ્પી એવોડ, ITK એવોડ વિગેરે એવોડસ સંબંધી કામગીરી અને પત્રવ્યવહાર કરવો.
૧૭	દરેક વિષય નિખાંત પાસેથી નિર્ધારિત પ્રકોર્મમાં થયેલ પ્રવૃત્તિની માહિતી ભેંગી કરી ફાઈલ બનાવવી. દર માસે પ્રથમ વીકમાં સ્ટાફ મિટિંગનું આયોજન કરવું.
૧૮	કૃષિ પ્રદર્શનની કામગીરી ટી-૩ અને ટી-૬ સાથે રહી કરવી.
૧૯	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૨૦	ATMA પ્રોજેક્ટ સંબંધી પત્રવ્યવહાર અને ફાઈલો નિભાવવાની કામગીરી.
૨૧	સોપેલ કલ્સટરમાં કેવિકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૨૨	વિષયને લગતાં નવા રીસર્ચ સ્ટડી તૈયાર કરી AGRESCO માં મંજૂર કરાવી તેના પરિણામોની રજૂઆત કરવી.
૨૩	વિષય સંબંધી કામગીરી કેવિકે પોર્ટલ પર ચઠાવવી.
૨૪	કચેરીના વડાની ગેરહાજરીમાં કચેરી / ફાર્મ વ્યવસ્થાની દેખરેખ.
૨૫	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોપે તે કામગીરી.
(૩) શ્રી. એસ. જે. ત્રિવેદી, વૈશાળીક (પાક ઉત્પાદન) (ટી-૨)	
૧	પાક ઉત્પાદન વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તન્સંબંધી ફાઈલો/ રેકડની જાળવણી.
૨	પાક ઉત્પાદનના પ્રથમ હોરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) સંબંધી કામગીરી.
૩	કલ્સટર ફાન્ટ લાઈન ડેમોન્સ્ટ્રેશના (NFSM, NMOOP & SMAM) નિર્દર્શનો (FLD) અને તેના પરીણામ સંબંધી કામગીરી.
૪	કેવિકે ફાર્મમાં પાક ઉત્પાદન, પાકોના નિર્દર્શન પ્લોટની તથા પાકોના પાક કૌતુકાલય તૈયાર કરવાની કામગીરી.
૫	કેવિકે ફાર્મનું મોનીટરીંગ કરી જરૂર જણાયે ફાર્મ મેનેજરને માર્ગદર્શન આપવું.
૬	સોપેલ કલ્સટરમાં કેવિકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૭	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્ય જગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક રજૂઆત કરવી.
૮	પાક ઉત્પાદનની નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૯	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી અને યોજનામાં ફાળવેલ ગ્રાન્ટનું નિયમોનુસાર આયોજન કરવું.
૧૦	ZREAC અને AGRESCO માં પાક ઉત્પાદન વિષયના પ્રથમ હોરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) નો ટાંક્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટની રજૂઆત કરવી.
૧૧	વિષયને લગતાં નવા રીસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરી ZREAC/AGRESCO માં મંજૂર કરાવી ફાર્મ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.
૧૨	રિવોલ્ટિંગ ફંડમાં આવક વધી તેવી પાક ઉત્પાદનની પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને તે સંબંધી કામગીરી.
૧૩	સીડ વિલેજ યોજનાને લગતી તમામ કામગીરી.
૧૪	જિલ્લાની ટ્રોયબલ સબ પ્લાન (TSP) યોજનાના સંકલન તથા પત્રવ્યવહારને લગતી તમામ કામગીરી.
૧૫	DAMU યોજનામાં ભરતી થાય ત્યાં સુધી નોડલ અધિકારી તરીકે તથા યોજના સંબંધી પત્રવ્યવહાર
૧૬	મજૂર મસ્ટર ચેક કરવાની જવાબદારી.
૧૭	વિષય સંબંધી કામગીરી કેવિકે પોર્ટલ પર ચઠાવવી.
૧૮	સિક્યુરિટી અંગે દેખરેખ તથા પત્રવ્યવહાર
૧૯	કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિષય સંબંધી કરેલ કામગીરી કેવિકે પોર્ટલ તથા અન્ય વેબસાઈટ પર અપલોડ કરવા તથા સમયાંતરે સંબંધિતને મોકલવાની કામગીરી.
૨૦	પ્રાકૃતિક ખેતી સંબંધી સંપૂર્ણ કામગીરી તથા પત્રવ્યવહાર
૨૧	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોપે તે કામગીરી.

**(૪) ડા. આર.કે. પટેલ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) (ટી-૩)**

૧	પાક સંરક્ષણ વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્ત્વબંધી ફાઈલો / રેકડની જાળવણી.
૨	પાક સંરક્ષણના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) સંબંધી કામગીરી.
૩	કેવિકે ફાર્મમાં પાક સંરક્ષણના નિર્દર્શન પ્લોટ તથા પાકોમાં પાક સંરક્ષણ કામગીરી.
૪	કેવિકે ફાર્મનું મોનીટરીંગ કરી પાક સંરક્ષણ સંબંધી ફાર્મ મેનેજરને માર્ગદર્શન આપવું.
૫	સૌંપેલ કલ્સટરમાં કેવીકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૬	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્ય જગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક રજૂઆત કરવી.
૭	પાક સંરક્ષણ નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૮	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી અને યોજનામાં ફાળવેલ ગ્રાન્ટનું નિયમોનુસાર આયોજન કરવું.
૯	ZREAC અને AGRESCO માં પાક સંરક્ષણ વિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૧૦	વિષયને લગતાં નવા રીસર્વ પ્રોજેક્ટ તૈયાર કરી ZREAC/AGRESCO માં મંજૂર કરાવી ફાર્મ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.
૧૧	જિલ્લામાં રજુ કરવાના RKVV પ્રોજેક્ટ સંબંધી પત્રવ્યવહાર તથા સંકલનની કામગીરી
૧૨	મેરા ગાંધી મેરા ગૌરવની કામગીરી તથા પત્રવ્યવહાર
૧૩	એડપ્ટીવ ટ્રાયલનું સંકલન અને તત્ત્વબંધી ફાઈલો અને પત્રવ્યવહાર
૧૪	વિષય સંબંધી કામગીરી કેવિકે પોર્ટલ પર ચઢાવવી.
૧૫	પલગ નર્સરી સંબંધી કામગીરીમાં ટી-૪ ને મદદરૂપ થવું.
૧૬	કેશબુક ખરાઈની જવાબદારી નીભાવવી.
૧૭	નવી ઓફીસ બિલ્ડિંગ અને હોસ્ટેલની દરખાસ્ત તથા પત્રવ્યવહાર ફાઈલ જાળવણી. ટી-૭ની મદદ લેવી.
૧૮	કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિષય સંબંધી કેવિકે પોર્ટલ તથા અન્ય વેબસાઈટ પર અપલોડ કરવા તથા સમયાંતરે સંબંધિતને મોકલવાની કામગીરી.
૧૯	વિષયાનુસાર પ્રાકૃતિક ખેતી સંબંધી કામગીરી
૨૦	RTI સંબંધી પત્રવ્યવહાર
૨૧	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સૌપે તે કામગીરી.
<b>(૫) પ્રો. બી.બી. પંચાલ, વૈજ્ઞાનિક (બાગાયત) (ટી-૪)</b>	
૧	બાગાયત વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્ત્વબંધી ફાઈલો / રેકડની જાળવણી.
૨	બાગાયતના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) સંબંધી કામગીરી.
૩	કેવિકે ફાર્મમાં બાગાયતી પાકોના નિર્દર્શન પ્લોટની તથા બાગાયતી/ઓષ્ઠ્યીય પાકોના પાક કૌતુકાલય તૈયાર કરવાની કામગીરી.
૪	કેવિકે ફાર્મનું મોનીટરીંગ કરી બાગાયતી પાકો સંબંધી ફાર્મ મેનેજરને માર્ગદર્શન આપવું.
૫	સૌંપેલ કલ્સટરમાં કેવિકેની દરેક વિષયની પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૬	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્યજગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક રજૂઆત કરવી.
૭	બાગાયતની નવી યોજનાઓની દરખાસ્તન કામગીરી.
૮	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી અને યોજનામાં ફાળવેલ ગ્રાન્ટનું નિયમોનુસાર આયોજન કરવું.
૯	ZREAC અને AGRESCOમાં બાગાયત વિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૧૦	વિષયને લગતાં નવા રીસર્વ પ્રોજેક્ટ તૈયાર કરી ZREAC/AGRESCOમાં મંજૂર કરાવી ફાર્મ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.

૧૧	પલગ નર્સરીની ખરીદી તથા મેનેજમેન્ટની સંપૂર્ણ જવાબદારી.
૧૨	રિવોલ્વિંગ ફંડમાં આવક વધે તેવી બાગાયતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને તે સંબંધી કામગીરી.
૧૩	ટી.એસ.પી. મેગાસીડ તરફથી મળતી ગ્રાન્ટનું આયોજન કરવું.
૧૪	NHM પ્રોજેક્ટને લગતી તમામ કામગીરી. પલગ નર્સરી યોજનાને સફળતા માટે તમામ જવાબદારી.
૧૫	કેન્દ્રની સુંદરતા વધારવા માટે ગાઈનીગ, લેન્ડસ્કેપીગ, પ્લાન્ટેશન વગેરેની કામગીરી.
૧૬	ટેરેશગાઈનનો વ્યાપ વધારવો
૧૭	વિષયાનુસાર પ્રાકૃતિક ખેતી સંબંધી કામગીરી
૧૮	વિષય સંબંધી કામગીરી કેવિકે પોર્ટલ પર ચઢાવવી.
૧૯	લાઈઝ્વેરીની સંપૂર્ણ કામગીરી.
૨૦	કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિષય સંબંધી કરેલ કામગીરી કેવિકે પોર્ટલ તથા અન્ય વેબસાઈટ પર અપલોડ કરવા તથા સમયાંતરે સંબંધિત મોકલવાની કામગીરી.
૨૧	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.
(૬)	<b>ખાલી જગ્યા(ટી-૫)</b>
૧	પશુપાલન વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલો / રેકડની જાળવણી.
૨	પશુપાલનના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) સંબંધી કામગીરી.
૩	કેવિકે ફાર્મમાં પશુપાલન વિષયના નિર્દર્શન એકમો તૈયાર કરવા.
૪	સોંપેલ કલ્સટરમાં કેવિકેની દરેક પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૫	વિષયને લગતી સફળ વાર્તા /કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્યજગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક રજૂઆત કરવી.
૬	પશુપાલનની નવી યોજનાઓની દરખાસ્તન કામગીરી.
૭	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી અને યોજનામાં ફાળવેલ ગ્રાન્ટનું નિયમોનુસાર આયોજન કરવું.
૮	ZREAC અને AGRESCO માં પશુપાલન વિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT)નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી.
૯	વિષયને લગતાં નવા રીસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરી ZREAC/AGRESCOમાં મંજૂર કરાવી ફાર્મ પર આયોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.
૧૦	નવી ઓફીસ બિલ્ડિંગ અને હોસ્પિટલની દરખાસ્ત, જરૂરી ખરીદી, કોન્ટ્રાક્ટરની કામગીરીની દેખરેખ વિગેરે તથા તત્સંબંધી ફાઈલો અને પત્રવ્યવહાર.
૧૧	રિવોલ્વિંગ ફંડમાં આવક વધે તેવી પશુપાલન પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને તે સંબંધી કામગીરી.
૧૨	કૃષિ પ્રદર્શનની કામગીરી ટી-૧ સાથે સંયુક્ત રીતે કરવી.
૧૩	જિલ્લામાં રજૂ કરવાના TSP પ્રોજેક્ટ સંબંધી પત્રવ્યવહાર તથા સંકલનની કામગીરી
૧૪	વિષય સંબંધી કામગીરી કેવિકે પોર્ટલ પર ચઢાવવી.
૧૫	કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિષય સંબંધી કરેલ કામગીરી કેવિકે પોર્ટલ તથા અન્ય વેબસાઈટ પર અપલોડ કરવા તથા સમયાંતરે સંબંધિત મોકલવાની કામગીરી.
૧૬	વિષયાનુસાર પ્રાકૃતિક ખેતી સંબંધી કામગીરી
૧૭	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી.
(૭)	<b>પ્રો. જી.જી. ભીમાદ્વારી, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન)(ટી-૬)</b>
૧	ગૃહવિજ્ઞાન વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલો / રેકડની જાળવણી.
૨	ગૃહવિજ્ઞાનના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT) સંબંધી કામગીરી.
૩	કેવિકે ફાર્મમાં ગૃહવિજ્ઞાન વિષયના નિર્દર્શન એકમો તૈયાર કરવા.
૪	સોંપેલ કલ્સટરમાં કેવિકેની દરેક પ્રવૃત્તિઓ થાય તે અંગે આયોજન કરવું.
૫	વિષયને લગતી સફળ વાર્તા/કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્ય જગ્યા અને સમયે તેની લેખિત અને મૌખિક

	રજૂઆત કરવી.
૬	ગૃહવિજાનની નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૭	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી અને યોજનામાં ફાળવેલ ગ્રાન્ટનું નિયમોનુસાર આપોજન કરવું.
૮	ZREAC અને AGRESCOમાં ગૃહવિજાન વિષયના પ્રથમ હરોળના નિર્ધારણો (FLD) અને ફાર્મ પરના અખતરાં (OFT)નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝટના આંકડાની રજૂઆત કરવી.
૯	વિષયને લગતાં નવા રીસર્વ પ્રોજેક્ટ તૈયાર કરી ZREAC/AGRESCO માં મંજૂર કરાવી ફાર્મ પર આપોજન કરી તેમજ તેના પરિણામોની રજૂઆત કરવી.
૧૦	કૃષિ પ્રદર્શનની કામગીરી ટી-૧ સાથે સંયુક્ત રીતે કરવી.
૧૧	ગૃહવિજાન વિષયક નવી યોજનાઓની દરખાસ્ત કરવાની કામગીરી.
૧૨	રીપોર્ટાંગની કામગીરીમાં ટી-૧ ને મદદરૂપ થવું.
૧૩	વિષય સંબંધી કામગીરી કેવિકે પોર્ટલ પર ચઢાવવી.
૧૪	કૃષિ વિજાન કેન્દ્રની વિષય સંબંધી કરેલ કામગીરી કેવિકે પોર્ટલ તથા અન્ય વેબસાઈટ પર અપલોડ કરવા તથા સમયાંતરે સંબંધિતને મોકલવાની કામગીરી.
૧૫	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોએ તે કામગીરી.
(૮)	શ્રી. એ.ટી. પટેલ, ફાર્મ મેનેજર (ટી - ૭) (સેવા વિ.દિ.નિ., નાયા, નવસારી ખાતે ફાળવવામાં આવેલ છે.)
૧	કેવિકે ફાર્મના ફાર્મના મેનેજર તરીકે સંપૂર્ણ જવાબદારી નિભાવવી.
૨	ફાર્મ પર લેવામાં આવતા બીજ ઉત્પાદનની કામગીરીમાં જરૂર જણાય ત્યાં ટી-૨ નાં માર્ગદર્શન મુજબ કરવી.
૩	ફાર્મની તમામ ખરીદી તથા તમામ રેકૉર્ડ્સ નિભાવવાની કામગીરી.
૪	મજૂર મસ્ટર તથા ફાર્મની એનિક હાજરી ભરવી.
૫	કેવિકેની જનરલ પાક યોજનાઓની મંજૂરીની કામગીરી.
૬	ફાર્મને લગતી તમામ ફાઈલો તથા પત્રવ્યવહારની કામગીરી.
૭	સ્ટોરને લગતા તમામ રેકૉર્ડ નિભાવવા તથા જાળવણી કરવી તેમજ ડેડસ્ટોકનો ચાર્જ સંભાળી તેને સંલગ્ન તમામ રેકૉર્ડ જાળવવા.
૮	રીવોલ્વીગ યોજના અંતર્ગત યુનિવર્સિટી ઉત્પાદકો ખરીદ કરી ખેડૂતોને મળે તે મુજબ આપોજન કરવું તથા તેના સ્ટોક તથા હિસાબો રાખવા.
૯	ચેપ રજીસ્ટર નિભાવવું.
૧૦	ટ્રેક્ટરની લોગબુક તથા હિસ્ટ્રીસીટ, કલ્ટીવેશન શીટ નિભાવવાની કામગીરી.
૧૧	કચેરીના દરેક વાહનોની આર.સી. બુક તથા વાહનોના વીમા અંગેની કામગીરી.
૧૨	ફાર્મનો સંપૂર્ણ સ્ટોર ચાર્જ.
૧૩	કેન્દ્ર ખાતે સિક્યુરીટીને લગતી તમામ બાબતોનું રેકૉર્ડિંગ અને રીપોર્ટાંગમાં ટી. ૨ને મદદરૂપ થવું.
૧૪	કેન્દ્ર પરના મકાનોની પરચૂરણ રીપેરીંગની કામગીરી.
૧૫	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોએ તે કામગીરી.
(૯)	શ્રી. વાય.ડી. પટેલ (પ્રોગ્રામ આસિસ્ટન્ટ-ટ્રેનિંગ) (ટી-૮) શ્રી. એ.ટી. પટેલ, ફાર્મ મેનેજરનો ચાર્જ પણ સંભાળી રહેલ છે.
૧	મંજૂરી, કન્યાયુમર/સ્ટોર રોજમેળ તમામ સ્થિતિના રજીસ્ટર નિભાવવા તથા જાળવણી કરવી. તમામ રેકૉર્ડ્સ જાળવવા.
૨	ખરીદી અંગેની તમામ કામગીરી.
૩	દરેક વિષય નિર્ણાંતરને તાલીમ આપોજન તથા તે સંબંધી તાંત્રિક કામગીરીમાં મદદરૂપ થવું.
૪	કૃષિ પ્રદર્શન સ્ટોલની કામગીરી ટી-૧ ની સાથે રહીને કરવી.
૫	નવી ઓફિસ બિલ્ડિંગ અને હોસ્પિટની દરખાસ્ત, જરૂરી ખરીદી, કોન્ટ્રાક્ટરની કામગીરીની દેખરેખ કરવી.
૬	કચેરીના તમામ ઓડિયો વિઝ્યુલ સાધનોની સાચવણી અને નિભાવણી કરવી.
૭	કચેરીના લાઈટબીલો તથા ટેલીફોન બીલોની ચુકવણી અને રજીસ્ટરો નિભાવવા.
૮	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોએ તે કામગીરી.

**(૧૦) શ્રીમતિ જે. ડી. પટેલ (ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ) (અ-૧)**

૧	કચેરી સંલગ્ન તમામ વહિવટ રેકોર્ડસની નિભાવવી જાળવણી કરવી.
૨	તમામ કર્મચારીઓની સર્વિસ બુક, પર્સનલ પી.એફ./એન.પી.એસ/સી.પી. એફ.બુક ફાઈલો તથા સી.આર.ના રેકોર્ડ્સ રાખવા.
૩	તમામ નાણાંકીય વ્યવહાર ICAR/યુનિ. તથા અધર એજન્સી સાથે જાળવવા તથા તે સંબંધી રેકોર્ડ્સ
૪	કચેરીના તમામ બજેટ સદરોની કેશબુક લખવાની કામગીરી તથા કેવિકે સિવાયનાં તમામ બ.સ.નાં બજેટ બનાવવાની કામગીરી તથા ખર્ચ – આવક તથા ડિટેઇલ રજીસ્ટરો નિભાવવાની કામગીરી.
૫	ડીમાન્ડ ઓફ ફંડ, AUC, કેશબુક (જનરલ તથા રિવોલ્વિંગ ફંડ), પગાર બીલ/ પગાર /ખથાં / ટીએ બીલ, એબસ્ટેક્ટ બીલ, પી.એ.ડી.એ./ એન.પી.ડી.સી., એરીયસ બીલ બનાવવા, અન્ય તમામ નાણાંકીય વ્યવહારનિભાવવા તથા તેને સંબંધિત જરૂરી ફોર્મ્સ / રજીસ્ટર રેકોર્ડ રાખવા.
૬	કચેરીના તમામ હિસાબો વખતોવખત કોમ્પ્લોલરશ્રી ની કચેરી ખાતે મેળવવા તથા ICAR / યુનિ. સાથે નાણાંકીય બાબતે પત્રવ્યવહાર જાળવવો.
૭	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોષે તે કામગીરી.

**(૧૧) શ્રી. સી. જી. લાડ (પ્રોગ્રામ આસિસ્ટન્ટ-કોમ્પ્યુટર) (અ-૨) (સેવા ડિ.નિ, નંદ્યુ, નવસારી ખાતે જાળવવામાં આવેલ છે.)**

૧	ઓનલાઈન પગાર તથા ઓનલાઈન એકાઉન્ટની કામગીરી.
૨	કેવિકેમાં આવેલ તમામ કમ્પ્યુટર, પ્રિન્ટર્સ, જેરોક્ષ મશીન વિગેરેનો સંપૂર્ણ હવાલો
૩	તમામ ઉપકરણોની સર્વિસ, મેન્ટેનન્સ તથા અપડેટીંગ રાખવું તથા કચેરીના તમામ કોમ્પ્યુટર અને લેપટોપના રીપેરીંગની જવાબદારી.
૪	કેવિકે હારા આયોજીત તાલીમ, સેમીનાર, વર્કશોપ દરમયાન હોલ/તાલીમ ખંડમાં/એલસીડી ની ગોઠવણ કરવી.
૫	તાંત્રિક અધિકારીશ્રીઓના પાવર પોર્ટન્ટ પ્રેઝન્ટેશન બનાવવામાં મદદરૂપ રહેવું.
૬	કેવિકે ખાતે તમામ ઈલેક્ટ્રોનિક/ઈલેક્ટ્રીકલ ઉપકરણોની ખરીદી માટે કચેરીને તાંત્રિક સલાહ સુચન તથા પત્ર વ્યવહાર કરી તેના સંબંધીત રેકોર્ડ જાળવવા.
૭	વહિવટી/હિસાબી કામગીરીમાં ઓન લાઈન બીલો ચઢાવવાની તેમજ ગ્રાંટ રજીસ્ટર નિભાવવાની કામગીરી.
૮	e-KVK ની તમામ કામગીરી (SMS મોકલવામાં વિષય નિષ્ણાંતશ્રીઓને મદદ કરવી )
૯	કેન્દ્ર ખાતે IT નો ઉપયોગ કરવા સંબંધિત તમામ જવાબદારી સંભાળવી.
૧૦	કેન્દ્ર ખાતે ઈન્ટરનેટ સેવા સતત અને કાર્યક્ષમ રીતે કાર્યરત રહે તે જોવું.
૧૧	Website અપડેટ કરવી.
૧૨	ટાટા સુમો ગારીની લોગબુક તથા હિસ્ટ્રીશીટ નિભાવવી.
૧૩	કોમ્પ્યુટર/ઈન્ટરનેટ/GeM પોર્ટલ/PFMS તથા બજેટ સંબંધી કામગીરી
૧૪	કેન્દ્રની દરેક પ્રવૃત્તિઓ વેબસાઈટ અને કેવિકે પોર્ટલ પર અપલોડ કરવાની જવાબદારી
૧૫	સ્ટાફની પ્રવાસ ડાયરી ચકાસણીની કામગીરી
૧૬	કચેરીની એકાઉન્ટની કામગીરીમાં એ-૧ને મદદરૂપ થયું.
૧૭	કચેરીની સ્ટેશનરી ખરીદી, રીકરીંગ / નોન રીકરીંગ, ટેલસ્ટોક ખરીદીની કાર્યવાહીની દેખરેખ રાખવી.
૧૮	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોષે તે કામગીરી.
૧૯	ઓડીટ સંબંધી પત્રવ્યવહાર
(૧૨)	કુ. જે. અમ. વર્મા (સ્ટેનોગ્રાફર) (અ-૩)
૧	કચેરીના તમામ પત્રવ્યવહારનું ગુજરાતી/અંગ્રેજી ટાઈપીંગ કરવું.
૨	બેન્કીંગની કામગીરી એ-૧ની સુચના અનુસાર કરવી.
૩	કચેરીના તમામ પત્રવ્યવહારનું ઈનવર્ડ/આઉટવર્ડની કામગીરી તથા સંબંધીત તમામ રેકોર્ડ્સ જાળવવા.
૪	પોસ્ટલ-રજીસ્ટર સંભાળવા.
૫	CL રજીસ્ટર નિભાવવું.
૬	સ્ટેશનરીની સુવિધા તથા કમ્પ્યુટરને લગતી તમામ જરૂરિયાતો પૂરી પાડવી.
૭	યુનિ. ખાતેથી મળવાપાત્ર તમામ સ્ટેશનરી/રજીસ્ટરો/રેકોર્ડ્સ/ફાર્મસ મેળવવા તથા તેની જાળવણી કરવી. અને

	કર્મચારી /અધિકારીની માંગ મુજબ પુરા પરા પાડવા. કેન્દ્રની સ્ટેશનરી સાચવણી અને રજીસ્ટરો નિભાવવા.
૮	કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત જે કામગીરી સૌંપે તે નિભાવવી.

**મુદ્દા નંબર :—૭ દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્ય રીતિ**

વહીવટી—વ—હિસાબી કર્મચારી / વૈજ્ઞાનિક» વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા» વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી/ સંશોધન નિયામકશ્રી / કુલસચિવશ્રી» કુલપતિશ્રી/ડાયરેક્ટરશ્રી, અટારી, પુના

**મુદ્દા નંબર :—૪ પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણા :—**

૧. ખેડૂતો અને ગ્રામીણ યુવાનો માટે "કાર્ય દ્વારા શિક્ષણ" પર ભાર મુક્કીને કૃષિ અને સંલગ્નવિષયો અંગે ટૂકાં તેમજ લાંબાગાળાના વ્યાવસાયિક તાલીમવર્ગો યોજીને સ્વરોજગારી વધારવાનો પ્રયત્ન કરવો.
૨. નવીન કૃષિ તજ્જાતોઓ અંગે ખેડૂતોના પ્રતિભાવો જાણવા માટે ખેડૂતોના ખેતરો ઉપર વિવિધ પાકોના પ્રથમ હુરોળના નિર્દર્શનો(Front line demonstrations) યોજવા.
૩. સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવવા સારુ નવી બહાર પાડવામાં આવતી કૃષિ તજ્જાતાઓની જુદી જુદી કૃષિ—આબોહવાકીય પરિસ્થિતિમાં યોગ્યતા અને અનુકૂળતા ચકાસવા માટે તથા ખેડૂતોને તે પ્રત્યક્ષ બતાવવા માટે ખેડૂતોના ખેતરો પર ક્ષેત્રિય—અભતરા(On-farm trials)નું આયોજન કરવું.
૪. કૃષિ અને સંલગ્નવિષયોના સંશોધનો સબંધી અધ્યતનમાહિતી અંગે જે તે કાર્યક્ષેત્ર વિસ્તારના વિસ્તરણ કાર્યકરો/અધિકારીઓને જાણકારી આપીને નવીન તજ્જાતા અંગેના શાનમાં વધારો કરવા માટે નિયમિત રીતે તાલીમ કાર્યક્રમો યોજવા.

**મુદ્દા નંબર :—૫ પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાના નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ :—**

કૃષિ યુનિવર્સિટીની સ્ટેચ્યુટરી જોગવાઈઓ મુજબ નિયમો, વિનિયમો અને સૂચનાઓને અનુસરવામાં આવે છે તેમજ માન. રાજ્ય સરકારશ્રીનાકૃષિ અને સહકાર વિમાગના આદેશો અનુસાર તથા કેન્દ્ર સરકારશ્રીના આઈસીએઆરની માર્ગદર્શન ડેટા કામગીરી કરવામાં આવે છે તથા હિસાબી કામગીરીનું લોકલ ફંડ ઓડીટરશ્રી દ્વારા ઓડીટ કરાવવામાં આવે છે. તેમજ અત્રેની એકમ દ્વારા જરૂરી રજીસ્ટરો નિભાવવામાં આવે છે જેવા કે, ડેડસ્ટોક, સ્ટોર રોજમેળ, ચીજવસ્તુ વપરાશ, મંજુરી રજીસ્ટર, લેબરસીટ, હાજરીપત્રક, રીપેરીગ, સાધનોની લોગબુક, વાહનની લોગબુક અને હીસ્ટ્રીસીટ, નમૂના રજીસ્ટર, પરચૂરણ રજા, ટપાલ આવક જાવક તથા હિસાબી રજીસ્ટરો જેવા કે કેશબુક, રસીદ બુક, માસિક ખર્ચ પત્રક રજીસ્ટર વિગેરે રેકર્ડની નિભાવણી કરવામાં આવે છે.

**મુદ્દા નંબર :—૬ પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દરસ્તાવેજોના વર્ગોનું પત્રક**

#### ૧. ટેકનીકલ(તાંત્રીક) દસ્તાવેજો

અ.નં.	ટેબલ	ફાઈલનો વિષય
૧.	વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા	૧. કૃવિકે, સુરતની શરૂઆત માર્ચ ૨૦૧૩ થી ૩૧/૦૩/૧૮ ની ફાઈલ ૨. ખાનગી પત્રવ્યવહારની ફાઈલ
૨.	ટી-૧ (વૈજ્ઞાનિક—વિસ્તરણ શિક્ષણ)	૧. આત્મા કનવર્જન્સ ફાઈલ ૨. કૃવિકે, સુરત: ગોનલ વર્કશોપ ૩. કૃવિકે, સુરત: QRT Report ૪. Zonal Coordinator – Technical Correspondence ૫. સુરત જીલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતોની યાદી

		<p><b>૬. PRA Report File</b>  <b>૭. ZREAC, Agresco &amp; Annual Progress Report</b></p>
૩.	ટી-૨ (વૈજ્ઞાનિક-પાક ઉત્પાદન)	<p>૧. ઓન / ઓફ કેમ્પસ ટ્રેનીગ રજીસ્ટર      ૨. એફ.એલ.ડી., ઓ.એફ.ટી. અંતર્ગત ઇનપુટ્સ સામગ્રીની પહોંચ ફાઈલ તથા રીજલ્ટ ફાઈલ      ૩. સીડ વિલેજ ફાઈલ      ૪. એડપ્ટીવ એફ.એલ.ડી. ફાઈલ      ૫. પ્લાન યોજના ફાઈલ</p>
૪.	ટી-૩ (વૈજ્ઞાનિક- પાક સંરક્ષણ)	<p>૧. ઓન / ઓફ કેમ્પસ ટ્રેનીગ રજીસ્ટર      ૨. એફ.એલ.ડી., ઓ.એફ.ટી. અંતર્ગત ઇનપુટ્સ સામગ્રીની પહોંચ ફાઈલ તથા રીજલ્ટ ફાઈલ      ૩. ટેબલને લગતા પત્રવ્યવહારની ફાઈલ      ૪. આર.ટી.આઈ પત્રવ્યવહારની ફાઈલ</p>
૫.	ટી-૪ (વૈજ્ઞાનિક- બાળાયત)	<p>૧. ઓન / ઓફ કેમ્પસ ટ્રેનીગ રજીસ્ટર      ૨. એફ.એલ.ડી., ઓ.એફ.ટી. અંતર્ગત ઇનપુટ્સ સામગ્રીની પહોંચ ફાઈલ તથા રીજલ્ટ ફાઈલ      ૩. ટેબલને લગતા પત્રવ્યવહારની ફાઈલ      ૪. ટી.એસ.પી. ફાઈલ      ૫. પ્લગ નર્સરી ફાઈલ</p>
૬.	ટી-૫ (વૈજ્ઞાનિક- પશુપાલન)	<p>૧. આર.ટી.આઈ. ફાઈલ      ૨. ઓન / ઓફ કેમ્પસ ટ્રેનીગ રજીસ્ટર      ૩. એફ.એલ.ડી., ઓ.એફ.ટી. અંતર્ગત ઇનપુટ્સ સામગ્રીની પહોંચ ફાઈલ તથા રીજલ્ટ ફાઈલ      ૪. ટેબલને લગતા પત્રવ્યવહારની ફાઈલ</p>
૭.	ટી-૬ (વૈજ્ઞાનિક- ગૃહ વિજ્ઞાન)	<p>૧ ઓન / ઓફ કેમ્પસ ટ્રેનીગ રજીસ્ટર      ૨. એફ.એલ.ડી., ઓ.એફ.ટી. અંતર્ગત ઇનપુટ્સ સામગ્રીની પહોંચ ફાઈલ તથા રીજલ્ટ ફાઈલ      ૩. લાઈબ્રેરી રજીસ્ટર      ૪. સામયીક મેગેઝીન નોંધણી રજીસ્ટર      ૫. લાઈબ્રેરી બૂક ઇસ્યુ રજીસ્ટર      ૬. લાઈબ્રેરી પત્ર વ્યવહાર ફાઈલ      ૭. પરચુરણ પત્ર વ્યવહાર ફાઈલ</p>
૮.	ટી -૭ (કાર્મ મેનેજર)	<p>૧. ફાર્મના પત્ર વ્યવહારની ફાઈલ      ૨. ઉત્પાદન રજીસ્ટર      ૩. વાહનની લોગ બુક (ડ્રેક્ટર, પાવર ટ્રેલર)      ૪. વાહનની હીસ્ટ્રી શીટ (ડ્રેક્ટર, પાવર ટ્રેલર)      ૫. ટેલસ્ટોક રજીસ્ટર      ૬. ફેનિક મજૂરી પત્રક      ૭. મજૂર તારીજ પત્રક      ૮. ઉધાર બીલ બુક      ૯. કેશ મેમો      ૧૦. કેશ મેમો – એબસ્ટ્રેક બુક      ૧૧. કચેરીમાં નાણાં ભરવાના પત્રક</p>

૮.	ટી-૮ (પ્રોગ્રામ આસિસ્ટન્ટ - ટ્રેનિંગ)	૧. સ્ટોર રોજમેળ ૨. ચીજ-વસ્તુ વપરાશ રજીસ્ટર ૩. સ્ટેશનરી રજીસ્ટર ૪. મંજૂરી રજીસ્ટર
૧૦.	એ-૨ (પ્રોગ્રામ આસિસ્ટન્ટ - કોમ્પ્યુટર)	૧. ગ્રાન્ટ રજીસ્ટર ૨. બિલ રજીસ્ટર ૩. લોગ બુક
૧૧.	એ-૩ (સ્ટેનોગ્રાફર)	૧. મુલાકાતી રજીસ્ટર ૨. ડૈનીક પોસ્ટલ સ્ટેમ્પના ખર્ચ રજીસ્ટર -એ, બી ૩. ઇનવર્ડ - આઉટવર્ડ રજીસ્ટર ૪. સ્ટેશનરી રજીસ્ટર ૫. હાજરી પત્રક (મસ્ટર રોલ) કેવિકે ૬. સી.એ.લ. રજીસ્ટર ૭. અંગત ફાઈલ

## ૨. દસ્તાવેજો

અ.નં.	ટેબલ	ફાઈલનો વિષય
<b>વહીવટી દસ્તાવેજો</b>		
૧.	એ-૧ (ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ)	૧. કેન્દ્રના દરેક અધિકારી/ કર્મચારીઓની સેવાપોથી/ રજા હિસાબ પુસ્તીકા/ જામીન ખત વગેરે દસ્તાવેજોની યોગ્ય જાળવણી તેને લગતા સઘણા રજીસ્ટરો ૨. કેન્દ્રના માસિકનિમાસિકપત્રકો અંગેની ફાઈલ. ૩. જનરલ પત્ર વ્યવહારની ફાઈલ. ૪. ઓડિટ અંગેના રેકર્ડની ફાઈલ. ૫. ઠરાવો પરિપત્રની ફાઈલ. ૬. કેન્દ્ર પર નિવૃત્ત થનાર અધિકારી/ કર્મચારીઓની પેન્શન દરખાસ્તની ફાઈલ. ૭. કર્મચારીઓની પ્રવાસ ડાયરીની ફાઈલ ૮. બજેટ ફાઈલ ૯. ગ્રાન્ટના હુકમોની ફાઈલ
<b>હિસાબી દસ્તાવેજો</b>		
૧.	એ-૧ (ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ)	૧. કેશબુકની ફાઈલ ૨. વાઉચરોની ફાઈલ. ૩. એન.પી.ડી.સી. બીલો, પે.ડી.સી. બીલોની ફાઈલ. ૪. કેન્દ્રના ખર્ચ - આવક અંગેના રજીસ્ટરો ૫. ઇન્કમટેક્ષ, પ્રો.ટેક્ષ, ચલણો વગેરેની ફાઈલ. ૬. જે તે નાણાંકીય વર્ષમાં ખર્ચ - આવકની ફાઈલ.

**મુદ્દા નંબર : - ૭ તેની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણ સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિધમાનકોઈ વ્યવસ્થાની વિગતો**

PRA સર્વે દ્વારા ગામના લોકોને સહભાગી બનાવી શ્રસ્ત એરીયા નક્કી કરી તે પ્રમાણે ખેતી વિષયક તાલીમો અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

**મુદ્દા નંબર :-** ૮ તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સિલો, સમિતિ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ

તેના ભાગ તરીકે બોર્ડ, કાઉન્સિલ, સમિતિ અને બીજા મંડળોની બેઠકો બનાવવામાં આવેલ નથી. પરંતુ વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ બનાવવામાં આવેલ છે. જેમાં ફક્ત સભ્યશ્રીઓ જ ભાગ લઈ શકે છે.

		Chairperson
1	Hon. Vice Chancellor, NAU, Navsari	Member
2	Director, ATARI, Zone VIII, Pune	Member
3	Director of Extension, NAU, Navsari	Member
4	Head, CSSRI (ICAR), RRS, Bharuch	Member
5	Professor & Head, Dept. of Agronomy, NMCA, Navsari	Member
6	Professor and Head, Dept. of Horticulture, NMCA, Navsari	Member
7	Research Scientist, LRS, NAU, Navsari	Member
8	Project Director ATMA, Surat	Member
9	DDM, NABARD, Surat	Member
10	District Agricultural Officer, Surat	Member
11	District Horticulture Officer, Surat	Member
12	Deputy Engineer, WALMI, Surat	Member
13	Deputy Director of Animal Husbandry, Surat	Member
14	Deputy Director of Fisheries, Surat	Member
15	Shri Ghelabhai S Patel, Progressive Farmer, Umara, Mahuva, Surat	Member
16	Smt. Vajaben Vasanthbhai Vasava, Chitalda, Umarpada, Progressive Woman Farmer	Member
17	Shri Manojbhai Patel, Agri Entrepreneur, Shekhpur, Surat	Member
18	Smt. Nishaben S. Chaudhary, Chairmen, SHG, Parvat, Mandvi	Member
19	Dr. J. H. Rathod, Senior Scientist and Head, KVK, Surat	Secretary

**મુદ્દા નંબર :-** ૯ તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા:-

અ.નં.	કર્મચારીનું નામ	હોદ્દો
૧	૨	૩
૧	ડૉ. જે. એચ. રાઠોડ	વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા
૨	ખાલી જગ્યા	વૈજ્ઞાનિક (વિસ્તરણ)
૩	શ્રી. એસ. જી. ત્રિવેદી	વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)
૪	ડૉ. આર. કે. પટેલ	વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)
૫	પ્રો. બી. બી. પંચાલ	વૈજ્ઞાનિક (બાળાયત)
૬	ખાલી જગ્યા	વૈજ્ઞાનિક (પશુપાલન)
૭	પ્રો. જી. જે. ભીમાણી	વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન)
૮	શ્રી. એ. ટી. પટેલ	ફાર્મ મેનેજર (સેવા વિ. શિ. નિ., નક્કુય, નવસારી ખાતે ફાળવવામાં આવેલ છે.)
૯	શ્રી. વાય. ડી. પટેલ	પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ટ્રેનીંગ
૧૦	શ્રીમતિ જે. ડી. પટેલ	ઓફિસ સુપ્રીન્ટેડર
૧૧	શ્રી. સી. જી. લાડ	પ્રોગ્રામ આસીસ્ટન્ટ- કોમ્પ્યુટર (સેવા ડિ. નિ, નક્કુય, નવસારી ખાતે ફાળવવામાં આવેલ છે.)
૧૨	કુ. જ્યોતિ એમ. વર્મા	સ્ટેનોગ્રાફર - ૩

મુદ્દા નંબર -૧૦ તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મહેનતાણા

અ.નં.	કર્મચારીનું નામ	પગાર ધોરણ	(માર્ચ-૨૦૨૩ અંતિમ)	
			પગાર	કુલ
૧	૨	૩	૪	૫
૧	ડૉ. જે. એચ. રાઠોડ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા	૧૩૧૪૦૦-૨૧૭૧૦૦	૧૬૧૬૦૦	૨૪૩૮૪૫
૨	વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)	--	--	--
૩	શ્રી એસ. જી. ત્રિવેદી વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)	૬૮૮૦૦-૨૦૪૫૦૦	૧૦૧૨૦૦	૧૩૬૮૭૮
૪	ડૉ. આર. કે. પટેલ વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)	૬૮૮૦૦-૨૦૪૫૦૦	૮૯૩૦૦	૧૩૨૨૨૦
૫	પ્રો. બી. બી. પંચાલ વૈજ્ઞાનિક (બાગાયત)	૫૭૭૦૦-૧૮૨૪૦૦	૬૮૮૦૦	૧૦૪૪૭૦
૬	ખાલી જગ્યા	--	--	--
૭	પ્રો. જી. જે. ભીમાણી વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન)	૬૮૮૦૦-૨૦૪૫૦૦	૮૪૮૦૦	૧૨૮૪૭૦
૮	શ્રી એ. ટી. પટેલ ફાર્મ મેનેજર	૩૬૬૦૦-૧૨૬૬૦૦	૪૬૨૦૦	૬૮૭૨૨
૯	શ્રી વાય ડી. પટેલ પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ટ્રેનીંગ	૩૬૬૦૦-૧૨૬૬૦૦	૪૭૬૦૦	૭૨૬૭૦
૧૦	શ્રીમતિ જી. ડી. પટેલ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ	૩૪૪૦૦-૧૧૨૪૦૦	૨૮૬૦૦	૫૬૨૨૩
૧૧	શ્રી સી. જી. લાડ પ્રોગ્રામ આસીસ્ટન્ટ- કોમ્પ્યુટર	૩૮૬૦૦-૧૨૬૬૦૦	૪૬૨૦૦	૬૬૬૦૪
૧૨	કુ. જ્યોતિ એમ. વર્મા સ્ટેન્ટોગ્રાફર	૨૫૫૦૦-૮૧૧૦૦	૨૭૧૦૦	૩૭૫૮૪

મુદ્દા નંબર -૧૧ તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને ચુકવેલા નાણાં પરના અહેવાલોની વિગતો દર્શાવતી, તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત ખાતે ચાલતી વિવિધ યોજનાઓની માહિતી નીચે મુજબ છે.

અ.નં.	યોજનાનું નામ	બજેટહેડ	ફાળવેલ ગ્રાન્ટ	(માર્ચ-૨૦૨૩ અંતિમ)	
				૪	૫
૧	ICAR	2704-05	1795300	16439199	
૨	Revolving Fund	2076-15	2441122	1009001	
૩	Strengthening of testing of university's technologies through farmer's Adaptive trials Phase - II	12306-C	900000	899970	
૪	NMOOP	2106	248850	437825	
૫	NFSM	2105-D	542093	298470	
૬	ACROSS	02121-00	2586605	2563954	
૭	TSP	2068-D	80545	76340	

૬	Microbial-based Agricultural Waste Management Using Vermicomposting under (SAP)	2132-00	24390	0
૮	Out scaling of Natural Farming through Krishi Vigyan Kendras	02148-04	266000	266000
૧૦	Kisan Bhagidari Prathmikta Hamari Campaign Kisan Mela...2022-23	02146-03	79490	57990
૧૧	Training And Capacity Building Program For Women In Dairy Farming Sector	18230-01	480000	480000

**મુદ્દા નંબર :- ૧૨ ફાળવેલ રકમો સહિત સબસિડી કાર્યક્રમોની અમલ બજ્વણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો**

આર્થિક સહાય આપવામાં આવતી નથી. પરંતુ FLD અંતર્ગત ઈન્ફુટસ આપવામાં આવે છે.

**મુદ્દા નંબર :- ૧૩ તેણે આપેલ છુટણાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો લાગુ પડતું નથી.**

**મુદ્દા નંબર :- ૧૪ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો**

નવસારી કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ [www.nau.in](http://www.nau.in) પર માહિતી મુકેલ છે.

**મુદ્દા નંબર :- ૧૫ જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય, તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચન કક્ષાના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો**

અતેની કચેરી ખાતે જાહેર ઉપયોગ હેતુ નાગરીકો માટે ઉપલબ્ધ નથી.

**મુદ્દા નંબર :- ૧૬ જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદાઓ અને બીજી વિગતો**

કચેરીનું નામ :— વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રીની કચેરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., સુરત

માહિતી અધિકારીનું નામ :— ડૉ. જે.એચ. રાઠોડ

હોદ્દો :— વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી

મદદનીશ માહિતી અધિકારીનું નામ :— ડૉ. આર. કે. પટેલ

હોદ્દો :— વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)

ફોન નંબર :— (૦૨૬૧) ૨૬૫૫૫૬૫

મોબાઇલ નંબર :— ૮૧૨૮૬ ૮૬૭૨૦

**મુદ્દા નંબર :- ૧૭ ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી પ્રસિદ્ધ કરવી જોઈશે અને ત્યારપણી દર વર્ષ આ પ્રકાશનોને અધાવત કરવા જોઈએ. હા**

જાહેર માહિતી અધિકારી અને  
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા  
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ.,  
અઠવા ફર્મ, સુરત

## એનોક્ષર-બી

(સામાન્ય વહિવટ વિભાગના તા. ૦૧-૦૫-૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક:-  
પીએડી-૧૦-૨૦૦૭-ઉત્પાદ્ય-આરટીઆઈ સેલનું બિડાણ)

## પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે માહિતી અધિકાર અધિનિયામની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો "પ્રોએક્ટીવ ડિસ્કલોગર (P.A.D.)" મારા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તા. ૦૧-૦૫-૨૦૨૭ની સ્થિતિએ અમારી મંજૂરી મેળવી અધ્યતન કરવામાં આવેલ છે.

તારીખ : ૦૧/૦૫/૨૦૨૭

  
જાહેર માહિતી અધિકારી અને  
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા  
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  
નવસારી કૃષિ યુનિવર્સિટી  
સુરત

  
ચાન્દુલિલ ચાટાઅધિકારી  
શા. ૧  
વિસ્તરણ શિક્ષણ નિયામક